

પેટલોદ નગરપાલિકા પેટલાદ.
 ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ
 કોમ્પની
 (નિયમ - ૯)

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬
 કલમો ૨૭ અને ૪૯ ઠેકણ પરવાનગી માટેની અરજી

પ્રતિ,
 મુખ્ય કારોબારી સત્તામંડળ/અધિકૃત અધિકારી,
 વિસ્તાર/શહેરી વિકાસ સત્તામંડળ, પેટલાદ

હું/અમે સાથે જોડેલા નકશા અને ડ્રોઇંગ્સ માં વર્ણવ્યા પ્રમાણે વિકાસ માટે પરવાનગી માટે અરજી કરું છું/કરીએ છીએ

સહી

તારીખ :- ----/----/----

૧.	અરજદારનું નામ	
૨.	ટપાલનું સરનામું	
૩.	જમીનમાંનું અરજદારનું હિત, હકપત્રક સાથે	
૪.	જમીનનું વર્ણન	
	મહેસૂલ	
	ગામ	
	નગર રચના યોજના	
	સરવે નંબર	
	ફાઇનલ પ્લોટ નંબર	
	સેબપ્લોટ નંબર	
૫.	ફાઇનલમાં જમીન અથવા મકાનનો કયો ઉપયોગ કરો છો?નો એક કરતાં વધુ ઉપયોગો હોય તો દરેક ઉપયોગની વિગતો આપવી	
૬.	જમીન અથવા મકાનનો સૂચિત ઉપયોગ જણાવતા વિકાસ કામનું ટૂંકમાં વર્ણન આપવું. જે જમીન અને/અથવા મકાનને એક કરતાં વધુ ઉપયોગમાં લીધાં હોય તો તે દરેક ઉપયોગની વિગતો આપવી.	
૭.	સમુચિત સત્તામંડળે મંજૂર કરેલ લે આઉટમાં આ જમીનનો સમાવેશ કર્યો છે. ?	હા / ના
	જો હા તો મંજૂર કર્યાની તારીખ અને સંદર્ભ નંબર, મંજૂર કરેલ લે આઉટની નકલ સાથે આપવા	
	જો ના, તો બીજા કોઈ પણ સત્તામંડળે મંજૂર કરેલ છે? મંજૂરીની તારીખ સાથે એવા સત્તામંડળનું નામ આપવું અને મંજૂર કરેલ લે આઉટની નકલ સાથે સંદર્ભ નંબર આપવો.	
૮.	રહેણાંકના ઉપયોગ માટે રહેણાંક યુનિટની સંખ્યા અને દરેક ભાગે ભોજનભિયાગ્રો વિસ્તાર.	
૯.	સૂચિત ઉપયોગ ઉદ્યોગ/વાણિજ્ય માટે હોય તો તે કેસમાં ઔદ્યોગિક અથવા વાણિજ્યિક સંસ્થાના કામનો પ્રકાર અને સીલ ઔદ્યોગિક અથવા વાણિજ્યિક માલ વાહનો માંથી ઉતારવા અને યથાવત માટે શી જુદી વ્યવસ્થા કરી છે? ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવા માટે કઈ વ્યવસ્થા કરવા શકી છે?	

અરજી સાથે સાદર કરવાના નકશા અને દસ્તાવેજો સંબંધી સ્વદારનો સૂચનો :-	
<p>નકશા અને ડ્રોઇંગ્સ યોગ્ય અને વધુ સમય ચાલે તેવા કાગળ ઉપર તૈયાર કરવા અથવા નકલો કરવી જેથી તે સ્પષ્ટ રીતે અને સહજ રીતે જોઈ શકાય. દરેક નકશો અને/અથવા ડ્રોઇંગ્સ ઉપર અરજદારે સહી કરવી જોઈશે અને તેના એન્જીનીયરે પણ સહી કરવી જોઈશે. અસલ નકશા અથવા ડ્રોઇંગ્સની નકલો સાદર કરવામાં આવી હોય તો તે તેની ખરી નકલો હોવી જોઈશે.</p> <p>લે-આઉટ પ્લાન (૩૫૫ નકલો)</p> <p>સમગ્ર જમીનનો લે આઉટ પ્લાન, મંકાન, બાંધકામ તરીકે વિકાસ કરવા માટે પરવાનગી માટેની દરેક અરજી સાથે અસૂક જોડવો જોઈશે.</p> <p>સ નકશો ૧.૨૦ મી. = ૫ .૦૦ મીટર કરતાં ઓછા સ્કેલમાં દોરેલો ન હોવો જોઈશે અને નીચે ની વિગતો દર્શાવવી જોઈશે.</p>	
૧.	અરજીમાં અને પેટા- વિભાગ બનતા તેના લે-આઉટમાં જુનાવેલ સરવે નંબર/પ્લોટો ની હદો
૨.	હાલનું મકાન અને બાંધવા ધારેલ નવું મકાન, રસ્તા, શેરી અને તેના ઉપરના માલ-લાવવા લઈ જવાના રસ્તા (હાલના બાંધકામ સૂચવેલ પેકી એકમાં જુદી રીતે દર્શાવવું જોઈશે.) સૂચિત નવા રસ્તા અને શેરીઓ તેના લેવલ અને પહોળાઈ.
૩.	પ્લોટમાં આવેલ દરેલ મકાન અને બાંધકામ ન કરવાની ખુલ્લી જમીનનો સૂચિત ઉપયોગ.
૪.	લે-આઉટ ઔદ્યોગિક અથવા વાણિજ્યિક ઉપયોગ માટે હોય તો, ભવિષ્યમાં કોઈ પણ વધારો કર્યા સિવાય બાંધી શકાય તેનો વધુમાં વધુ વિસ્તાર.
૫.	લે-આઉટ ઔદ્યોગિક અથવા વાણિજ્યિક ઉપયોગ માટે હોય તો, ભવિષ્યમાં કોઈ પણ વધારો કર્યા સિવાય બાંધી શકાય તેનો વધુમાં વધુ વિસ્તાર.
૬.	વિદ્યમાન સગવડો, જેવી કે માર્ગી ગટર વગેરે, પાણીની લાઇન, ગટર, ગંદા તેમજ વરસાદીના પાણી ના નિકાલ માટેની લાઇનનો વ્યાસ અને રાખ.
૭.	જાહેર રસ્તાની નજીકના સંબંધમાં સ્થળ
૮.	મુખત રસ્તા ઉપરથી પ્લોટમાં પ્રવેશાય તેવા રસ્તા સહિત તમામ વિદ્યમાન રસ્તાના જોડાણો અને પહોળાઈ. વિદ્યમાન પ્રવેશ રસ્તા અને સૂચિત નવા રસ્તા હોય તો તે, સ્પષ્ટ રીતે અને અલગ દર્શાવવા જોઈશે.
૯.	વિદ્યમાન ગ્રાડ અને સાચવી રાખવા જેવા કુદરેતી કીમતી દૃશ્યો.
૧૦.	દરેલ મળવાના લોચતળિયાના વિસ્તાર સાથે વિદ્યમાન તેમજ સૂચિત મકાન માટે ૧.૨૦ મી. = ૫.૦૦ મીટર કરતાં ઓછા ન હોય તેવા સ્કેલમાં, ડ્રોઇંગ્સ (૨ નકલો)
	સહી

પેટલાદ નગરપાલિકા પેટલાદ.
સમુચિત સત્તામંડળ માટે ચેકલીસ્ટ.

પેટલાદ નગરપાલિકા વિકાસ પરવાનગી/બાંધકામ પરવાનગીની અરજી અંગેનું ચકાસણી પત્રક.

(૧) સામાન્ય વિગત :-

(૧) અરજદાર /કુલ મુખત્યાર નું નામ :-

(૨) ગામનું નામ :- પેટલાદ. રેસન ----- સી.સ.ન----- ટી.પી.સ્કીમ
નંબર-----ફાઇનલપ્લોટ નંબર-----સબપ્લોટ નંબર----- ક્ષેત્રફળ-----
----- ચો.મી.રહેણાંક/વાણિજ્ય/ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે અરજી કરેલ છે.

(૩) ઇનવર્ડ નંબર/તારીખ-----

(૪) પાસ્ટ રફરન્સ

અત્રેની કચેરીના પત્રનં.-----ની ----- થી મંજૂરી
મળેલ છે./ માહિતી મંગાવેલ હતી / ના મંજૂર કરેલ છે./

(૨) ચકાસણી ફી ની વિગત :-

(અ) કુલ જમીન -----ચો.મી.ના રૂા.-----પ્રતિ
ચો.મી લેખે કુલ ગ્રણ----- ફી તથા

(બ) કુલબાંધકામ----- ચો.મીના રૂા.----- પ્રતિ ચો.મી લેખે
રૂા.----- (અ-બ) મળી કુલ ફી.રૂા.----- અત્રેની
કચેરીના રસીદ નંબર (૧) બાંધકામ પાણી લાગત-----

(૨) બાંધકામ લાગત----- (૩) બાંધકામ શોષ -----
તા----- થી ભરાયેલ છે. જે નિયમ અનુસાર બરાબર છે / ઓછી છે.

(ક) ડેવલપમેન્ટ ચાર્જની વિગત :-

(૩) માલીકી પુરાવા :-

(૧) ૭/૧૨ પ્રોપર્ટી કાર્ડની પ્રમાણીત નકલ રજૂ કરેલ છે?----- હા / ના

(૨) જમીનનો સત્તાપ્રકાર:-

(૩) જમીન માલીકીનું નામ રેકર્ડ સામે સુરંગત છે? ----- હા / ના

(૪) માલીકી હકક પુરાવા અંગે દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ છે?----- હા/ ના

- (૫) સવાલવાળી જમીનનું કોમ્પ્લેક્શન રેકર્ડ સાથે સંસંગત થાય છે?----- હા / ના
- (૬) જમીનનું એકત્રીકરણ કે વિભાગીય કરણ થયેલ હોય તો તે માટેના પુરાવા રજૂ કરેલ છે?----- હા / ના
- (૭) રજૂ કરેલ નકશામાં માલીકોની સહી કરેલ છે? હા / ના
- (૮) (અ) સબપ્લોટીંગ અગાઉ મંજૂર કરેલ છે? ----- હા / ના
- (બ) બીનખેતી થયેલ હુકમ તથા લે-આઉટ પ્લાનની પ્રમાણિત નકશા રજૂ કરેલ છે?----- હા / ના

મોજે પેટલાદ તા-----ના સી.સ.નં.-----ના ક્ષેત્રફળ----- ચો.મી.
ના ----- હેતુ માટે રજુ કરેલા નકશા અન્વયે પ્રશ્નવાળી જમીન અંગે વિકાસ
યોજનાની દરખાસ્ત અન્વયે ઝોન/રસ્તા/રીઝર્વેશન/ડી.પી.રોડની અસર વિગેરે બાબતે
આપનો અભિપ્રાય પાઠવી આપશો.

સર્વેચર/પ્લા.આસી.

પ્રતિશ્રી,

સર્વેચર/પ્લા.આસી.શ્રી

પ્રશ્નવાળી જમીન બાબતે આલેખન શાખાનો અભિપ્રાય નીચે મુજબ છે.

- (૧) પ્રશ્નવાળી જમીન ----- ઝોનમાં આવે છે.
- (૨) પ્રશ્નવાળી જમીન/પેકીની જમીનમાં રીઝર્વેશનની અસર થાય છે / થતી નથી.
- (૩) પ્રશ્નવાળી જમીન ને ડી.પી. રસ્તાની/રેલ્વે કાઠન ની અસર થાય છે / થતી નથી.
- (૪) રજુ કરેલ માપણીશીટ મુજબ પ્લાનમાં દર્શાવેલ માપો મળી રહે છે/મળી રહેતાનથી.
- (૫) રજુ કરેલ નકશાના કી પ્લાન/નોર્થ લાઇન ડી.પી મુજબ દર્શાવેલ છે. હા / ના

તા :----/----/-----

ટીપીડીમેન/ટ્રેસર

(૪) વિકાસ યોજનાની અસર :-

- (૧) સવાલવાળી જમીન વિકાસ યોજનામાં સમાવેશ કરેલ છે? હા / ના
- (૨) ઝોનની વિગત :-રહેણાંક / વાણીજય / ઔદ્યોગિક / ખેતીવાડી / અનામત વિસ્તાર
- (૩) સુચિત ઉપયોગ મળવાપાત્ર છે?
- (૪) વિકાસ યોજના રસ્તાની અસર થાય છે?
- (૫) વિકાસ યોજનાનું ઝોનીંગ સર્ટીફિકેટ તથા પાર્ટ પ્લાન રજુ કરેલ છે?
- (૬) ડ્રોઇંગ શાખાનો અભિપ્રાય મેળવેલ છે?
- (૭) વિકાસ યોજના મુજબ રસ્તામાં જતી જમીનનું ક્ષેત્રફળ કુલ----- માંથી બાદ કરેલ છે?

(૫) નકશાની વિગત :-

- (૧) કી પ્લાન દર્શાવેલ છે? ----- હા / ના
(૨) નોંધ લાઇન અને સ્કેલ દર્શાવેલ છે? ----- હા / ના
(૩) કી-પ્લાન અને લે-આઉટ પ્લાનની વિગત:-

જમીન રેકર્ડ સાથે સુસંગત થાય છે.

- (૪) પ્રશ્નવાળી જમીનને હયાત રસ્તાની અધિકૃત રસ્તાનો પ્રવેશ મળેલ છે?
(૫) જો ન મળતો હોયતો અન્ય જમીનમાંથી મેળવેલ રસ્તા અંગેની સંમતી મેળવી રજૂ કરેલ છે?
(૬) પ્રવેશ રસ્તો લે આઉટ પ્લાનમાં દર્શાવેલ છે?
(૭) અન્યની માલિકીની જમીનમાંથી મેળવવાના પ્રવેશ રસ્તા બાબત દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ છે?
(૮) કોઈ કરાર કે કબજા ફેરફાર અંગેની સંમતી રજૂ કરેલ છે?
(૯) અધિકૃત/વર્ગિકૃત રસ્તાથી નિયમ મુજબ છોડવાપાત્ર કટોલ લાઇન દર્શાવેલ છે?
(૧૦) એસ.ટી/એલ ટી ઇલેક્ટ્રીક લાઇન/ગેસ લાઇન વર્ગિકૃત રસ્તો/રેલ્વે/કેનાલ/નદી-તળાવ સંપાલવાળી જમીનમાંથી/મસાર થાય છે કે કેમ?

જો તેમ હોયતો તે માટે જરૂરી અંદર/માર્જિન છોડેલ છે કે કેમ? તે અંગે સંબંધિત ખાતાનો અધિપ્રાય મેળવેલ છે કે કેમ?

(૬) આકીટેકટ / એન્જનીયર / સુપરવાઇઝર ની વિગત :-

- (૧) આકીટેક / એન્જનીયર નું નામ :-----
(અ) ન.પા. લાયસન્સ મેળવેલ છે----- તોનો રજિસ્ટ્રેશન નં-----
(બ) રજુ કરેલ નકશામાં સહીસિકકા કરેલ છે?----- હા / ના
- (૨) સ્ટ્રાકચર એન્જનીયર નું નામ :-----
(અ) ન.પા. લાયસન્સ મેળવેલ છે----- તોનો રજિસ્ટ્રેશન નં-----
(બ) રજુ કરેલ નકશામાં સહીસિકકા કરેલ છે?----- હા / ના
(ક) બાહ્ય પત્રક રજુ કરેલ છે?
ર(એ)ઘર(બી), સ(સી).ર(ડી) સંપૂર્ણ વિગતો સાથે વરૂદી સહી સિકકા સાથે રજુ કરેલ છે?
(ક) સુપરવાઇઝરનું નામ :-----
(ચા) ન.પા. લાયસન્સ મેળવેલ છે----- તોનો રજિસ્ટ્રેશન નં-----
(બ) રજુ કરેલ નકશામાં સહીસિકકા કરેલ છે?----- હા / ના
તારીખ

(૭) લે આઉટ / સબપ્લોટીંગ :-

- (૧) પ્લાનમાં દર્શાવેલ હેતુ / ક્ષેત્રફળ ડીસીઆર ને સુસંગત છે કે કેમ ?
(૨) સબપ્લોટ / રેવન્યુ સર્વે નંબર ના હદોના માપ દર્શાવેલ છે?
(૩) સવાલવાળી જમીનના બાહ્ય માપો સાથે સબપ્લોટનો માપ સંસંગત થાય છે કે કેમ?
(૪) રસ્તાઓ આયોજનની દૃષ્ટિએ યોગ્ય છે?
(૫) સબપ્લોટના ક્ષેત્રફળ માંથી ગોળાઈ બાદ કરેલ છે?
(૬) ચાંતરીક રસ્તાઓ નિયમ મુજબ દર્શાવેલ છે?
(૭) ડેડ એન્ડ પ્લોટ ઉપર કલડિસેક દર્શાવેલ છે?
(૮) ક્ષેત્રફળના કોષ્ટકમાં સબપ્લોટ કોમનપ્લોટ તથા ચાંતરીક રસ્તાનું ક્ષેત્રફળ સાથે સુસંગત થાય છે?
(૯) સુચિત બાંધકામ અલગ રંગથી દર્શાવેલ છે?
(૧૦) સબપ્લોટમાં સુચવેલ બાંધકામ મળવાપાત્ર મર્યાદા માં છે?
(૧૧) સબપ્લોટમાં સુચિત બાંધકામના માર્જિન નિયમ મુજબ છે?
(૧૨) મળવાપાત્ર બીલ્ડઅપ એરીયાની ગણતરી દર્શાવેલ છે?
(૧૩) આંતરીક રસ્તાની પહોળાઈના પ્રમાણમાં જે તે પ્લોટનું ક્ષેત્રફળ મળવાપાત્ર થાય છે કે કેમ?
(૧૪) કોમન પ્લોટ / લોડીંગ -અન લોડીંગ નિયમોનુસાર રાખેલ છે?
(૧૫) કોમન પ્લોટનું ક્ષેત્રફળ નિયમોનુસાર ઓછામાં ઓછું રાખેલ છે?
(૧૬) કોમન પ્લોટની હદોના માપો દર્શાવેલ છે?
(૧૭) કોમનપ્લોટની હદોના માપ નિયમ મુજબ રાખવા પાત્ર ઓછામાં ઓછા રાખેલ છે?

(૮) બાંધકામ પ્લાન:-

(૧)	સી.ઓ પી /કોમનપ્લોટ નિયત દર્શાવેલ છે?	હા	ના
(૨)	હદોથી સુચિત બાંધકામનું માર્જન/ કોમનપ્લોટ થી સુચિત બાંધકામનું માર્જન તથા બે બાંધકામ વચ્ચેનું માર્જન નિયમ મુજબ છે?	હા	ના
(૩)	પ્રોજેક્શન નિયમ મુજબ છે?	હા	ના
(૪)	કુલ સુચિત બાંધકામનું ક્ષેત્રફળ મળવાપાત્ર બાંધકામ ક્ષેત્રફળ ની મર્યાદા માં છે?	હા	ના
(૫)	ટ્રેનેજ લાઇન દર્શાવેલ છે?	હા	ના
(૬)	સુચિત બાંધકામની ઉંચાઇ નિયમ મુજબ છે?	હા	ના
(૭)	નિયમ મુજબ પાર્કિંગ મળી રહે છે ?	હા	ના
(૮)	નિયમ મુજબ એન્ટી મળી રહે છે?	હા	ના
(૯)	બાંધકામ પ્લાન સ્કેલ ૧ સે.મી-૧ મીટરના સ્કેલમાં રજુ કરેલ છે?	હા	ના
(૧૦)	સીડીમાંથી પત્તાર થતો સેક્શન / પ્લાન એલીવેશન દર્શાવેલ છે?	હા	ના
(૧૧)	પ્રોજેક્શન /બાલ્કની નિયમ મુજબ છે?	હા	ના
(૧૨)	ફાઉન્ડેશન, દીવાલની જાડાઇ, રૂમોની સાઇઝ, વેન્ટીલેશન રૂમ, રસોડું, બાથરૂમ, બાથરૂમ, વિગેરે નિયમ સાધાર્ણ છે?	હા	ના
(૧૩)	સીડી ની પહોળાઇ તેમજ વેન્ટીલેશન દર્શાવેલ છે?	હા	ના
(૧૪)	એન્ટીના પગથીયાં દર્શાવેલ છે?	હા	ના
(૧૫)	રૂમોના માપ, દીવાલોના માપ, પેસેજ, વીગેરેની સરવાળો કુલ માપ મુજબ દર્શાવેલ છે?	હા	ના
(૧૬)	એરીયાટેબલ, પ્લોટક્ષેત્રફળ, બાંધકામક્ષેત્રફળ, મુલ્લી જગ્યા વિગેરે દર્શાવેલ છે?	હા	ના
(૧૭)	સેક્શનપ્લાન, એલીવેશન દર્શાવેલ છે?	હા	ના
(૧૮)	પ્લીનથ હાઇટ, રૂમહાઇટ બરાબર છે?	હા	ના
(૧૯)	રસ્તાની પહોળાઇ દર્શાવેલ છે? તે મુજબ બાંધકામ / ઉંચાઇ મળવાપાત્ર છે?	હા	ના
(૨૦)	એફ.એસ.આઇ.બરાબર છે?	હા	ના
(૨૧)	કોમન પ્લોટથી નિયમ અનુસાર માર્જન અંતર છોડેલ છે?	હા	ના

(૯) સ્થળ નિરીક્ષણ રીપોર્ટ :-

પ્રસ્નવાળી જમીનનું સ્થળ નિરીક્ષણ ને તા ----/----/---- ના રોજ કરેલ છે. સ્થળ નિરીક્ષણ કરતા નીચે જણાવ્યા મુજબનું બાંધકામ થયેલ છે.

(૧૦) અભિપ્રાય :-

રજુ કરેલ નકશાઓ તેમજ સામેલ કરેલ આધારો આપેલ અભિપ્રાય મુજબ ઉપરોક્ત વિગતોએ નીચે દર્શાવેલ શરતી મુજબ નકશામાં લાલરંગથી દર્શાવેલ સુધારા મુજબ વિકાસ પરવાનગી થી મંજુર કરીએ / ના મંજુર કરીએ શરતો:-

(૧)

(૨)

ઇજનેટ નગરપાલિકા પેટલાદ

ચીફ ઓફીસરશ્રી
પેટલાદ નગરપાલિકા

ફોર્મ નંબર ૨ (ઓ)
રજિસ્ટર્ડ આર્કિટેક્ટ / એન્જીનીયરનું બાંહેધરી આપતું પ્રમાણપત્ર

પ્રતિ,

રેક. સૂચિત બાંધકામ : -----

પ્રોજેક્ટનું નામ

સી. એસ. નં./રે. સ. નં./ડા. પ્લો. નં. -----
શેર/વોર્ડ નં. ----- ગામ -----
તા. ----- ટી. પી. સ્કીમ નં. ----- ગામ/નગર/ઘાટેર
ના માટે. માલિક/સંયોજક/વિકાસ કર્તા/બીલ્ડરનું નામ

સરનામું

ટેલીફોન નં. -----

હું કાઉન્સિલ ઓફ આર્કિટેક્ટનો સભ્ય છું/છું રજિસ્ટર્ડ એન્જીનીયર તરીકે હાલનું રજીસ્ટ્રેશન ધરાવું છું.

હું વિકાસ નિયંત્રણ વિનિયમના કાયદાની જોગવાઈ અનુસારની જરૂરિયાત પ્રમાણે ઉપર જણાવેલ પ્રોજેક્ટના પ્લાન, સેક્શન તથા બીજાં વિગતો તૈયાર કરવા માટે રજિસ્ટર્ડ આર્કિટેક્ટ / એન્જીનીયર / સર્વેયર તરીકે નિમાયેલ છું. તેવું પ્રમાણપત્ર આપું છું. અને મે સદર નકશા વગેરે બનાવેલ છે અને તેની ઉપર સહીસિક્કા કરેલ છે. તદુપરાંત મંજૂર થયેલ નકશા પ્રમાણે મારી સૂચના અને સુપરવિઝન હેઠળ પ્રોજેક્ટનું બાંધકામ કરવામાં આવશે. હું હાલમાં અમલા આવેલ વિનિયમોથી અને તે અન્વયે મારી ફરજો તથા જવાબદારીઓથી સંપૂર્ણ વાકેફ છું. અને તેનું સમગ્રતયા પાલન કરવાની બાંહેધરી/ખાત્રી આપું છું.

ઉપરાંત હું પ્લમ્બીંગ (પાઈપ લાઈનો વગેરે) નું કામ, ગટર, વ્યવસ્થા, સ્વાસ્થ્ય રક્ષકતા, પાણી પૂરવઠો વગેરે માટે પૂરતા પગલા લેવાની પણ ખાત્રી આપું છું. જે તે કામની શરૂઆત કરતા પહેલા જે તે કામ માટે સાઈટ સુપરવાઈઝર

કલાર્ક ઓફ વર્કસ, બાંધકામ કોન્ટ્રેક્ટર, પ્લાબ્લીગ મોનિટર અને ઈલેક્ટ્રીકલ કોન્ટ્રેક્ટરની જે તે વખતે નિમણૂક કરવામાં આવશે.

સહી : _____

રજીસ્ટ્રેશન નં. _____

તારીખ : _____

નામ : _____

સરનામું : _____

ટેલીફોન નં. _____

(જ્યાં લાગું ના પડતું હોય તે છેકી નાંખવું)

૧૨૫૮

ફોર્મ નંબર ૨ (સી)
 રજિસ્ટર્ડ ક્લાર્ડ ઓફ વર્કસ/સાઈટ સુપરવાઈઝર/વિકાસ કર્તા/ માલિકની બાંહેધરી
 પ્રમાણપત્ર

પ્રતિ,

રેફ. સૂચિત બાંધકામ :

સી.અ.સ.નં./રે.સ.નં./કા.પ્લો.નં. ----- (કામનું નામ) ----- ગામ
 તાલુકા : ----- વોર્ડ -----
 ટી.પી. સ્કીમ નં. ----- ગામ -----
 માલિક: -----
 સરનામું: -----
 ટેલીફોન નં. -----

હું રજીસ્ટર્ડ ----- તરીકે કામ કરવા માટે હાલનું રજિસ્ટ્રેશન પરાવું છું.

હું આથી પ્રમાણપત્ર આપું છું કે ઉપરોક્ત પ્રોજેક્ટ માટે રજિસ્ટર્ડ -----

તરીકે નિભાયેલ છું. અને ખાત્રી આપું છું કે મારા નેજા હેઠળનું સમગ્ર બાંધકામ સુસંગત આઈ.એસ.આઈ. પ્રમાણે તથા નેશનલ બીલ્ડીંગ કોર્ડમાં દર્શાવેલ શરતો અનુસાર કરવામાં આવશે.

હું હાલમાં અમલમાં આવેલ વિનિયમોની જોગવાઈઓથી અને તે અન્વયે મારી ફરજો તથા જવાબદારીઓથી સંપૂર્ણપણે વાકેફ છું; અને તેને સંપૂર્ણ તથા અમલમાં મૂકવાની ખાત્રી આપું છું.

હું વિકાસ નિયંત્રણ વિનિયમો અન્વયે એકી સાથે દસથી વધુ કામોનું સુપરવીઝન કરી શકી નહીં;
 હું આ કામની સુપરવીઝન દરમિયાન એકી વખતે બીજા કોઈપણ સાઈટના કામનું સુપરવીઝન નહીં કરવાની ખાત્રી આપું છું.

સહી: -----

રજીસ્ટ્રેશન. -----

તારીખ: -----

નામ : -----

સરનામું: -----

ટેલીફોન નં. -----
 (જ્યાં લાગુ ના ચક્રું હોય તે ઉકી નાંખવું)

ફોર્મ નંબર ૨ (બી)
રજિસ્ટર્ડ સ્ટ્રક્ચરલ એન્જીનિયરનું બાંહેધરી પ્રમાણપત્ર

પ્રતિ,

રેફ. સૂચિત બાંધકામ :

(કામનું નામ)

શ્રી એસ.નં./રે સ.નં./કા.પ્લો.નં. ----- વોર્ડ ----- ગામ

તાલુકા : -----

ડી.પી.સ્કીમ નં. ----- ગામ/નગર/સાહેર -----

માલિકનું નામ -----

સરનામું -----

ટેલીફોન નં. -----

હું સ્ટ્રક્ચરલ ડીઝાઈનર તરીકે કામ કરવા માટે હાલનું રજિસ્ટ્રેશન ધરાવું છું. ઉપરોક્ત પ્રોજેક્ટ માટે સ્ટ્રક્ચરલ રીપોર્ટ, સ્ટ્રક્ચરલ ડીટેઈલ્સ અને સ્ટ્રક્ચરલ તકશા તૈયાર કરવા માટે રજિસ્ટર્ડ ડીઝાઈનર તરીકે નિમાણેલ હું તેનું પ્રમાણપત્ર આપું છું.

હું વિનિયમો હેઠળની મારી ફરજો તથા જવાબદારીઓથી સંપૂર્ણપણે વાકેફ છું. અને તે બાબતે તેનું સંપૂર્ણપણે પાલન ધરો તેની ખાત્રી આપું છું. મેં સૂચિત મકાનની સ્ટ્રક્ચરલ ડીઝાઈનર તથા ડોઈંગ તૈયાર કરેલ છે અને સહી સિકકા કરેલ છે. વધુમાં ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન પ્રમાણે તેની સ્ટ્રક્ચરલ ક્ષમતા તથા સલામતીને પ્રમાણિત કરું છું. હું માલિકને તથા સુપરવાઈઝરને વિગતવાર નકશા આપવાની ખાત્રી આપું છું. જો મારી સેવાઓ રદ કરવામાં આવશે તો સક્ષમ અધિકારીને લેખિત જાણ કરવાની ખાત્રી આપું છું.

સહી: -----

રજીસ્ટ્રેશન નં. -----

તારીખ: -----

નામ: -----

સરનામું: -----

ટેલીફોન નં. -----

(જ્યાં લાગુ ના પડતું હોય તે છેકી નાંખવું)
